Admin. Off.: Cello House, Corporate Avenue, 'B' Wing, 1st Floor, Sonawala Road, Goregaon (E), Mumbai - 400 063, (India).

- T.: (022) 2686 3426 / 2686 3427 / 2686 4630
- E : wimplast@celloworld.com
- W : www.cellowimplast.com, www.cellobubbleguard.com

cello Wim Plast Ltd.

(An ISO 9001: 2008 Company)

May 31, 2023

To, Listing Department **BSE Limited** Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai – 400 001.

Scrip Code: <u>526586</u>

Scrip ID: WIMPLAST

Sub: <u>Submission of Newspaper Advertisement regarding Audited Financial Results of</u> <u>the Company for the fourth quarter and year ended 31st March, 2023</u>

Dear Sir/ Madam,

In terms of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, enclosed herewith is the copy of Newspaper Advertisement of Audited Financial Results for the fourth quarter and year ended 31st March, 2023 published in Newspapers – Business Standard (English) and Gujarat Mitra (Gujarati) on 31st May, 2023.

Kindly take the same on your record.

Thanking you.

Yours faithfully,


For Wim Plast Limited

Darsha Adodra Company Secretary & Compliance Officer (Mem. No. : A32331)

End: A/a

2 JACKET

| Regd Office: Marson Chakmir, M Setting po | laheshtala, Koll | kata-700142 | | n | | |
|---|--------------------------------|-------------------------------------|---------------------------|--|------------|---|
| | | | | | Sr. No. | Pa |
| EPS up by | | Net Pro up by | | Γ | 1. | Total Inc |
| / 380% / | | 367 % | /0 / | | | Exceptio |
| | | | | | 3. | Net Prof (after Ex |
| AUDITED FINANCIAL RESULTS | FOR THE QU | ARTER/YE | | 31.03.2023 es in Rs. Lacs) | 4. | Net profi (after Ex |
| | | STAND | ALONE | | 5. | Total Co [Compri |
| Particulars | Quarter Ended 31.03.2023 | Current Year Ended 31.03.2023 | Previous Year Ended | Corresponding 3 Months Ended in the Previous Year | 6. | and othe |
| Total Income from Operations (Not) | 779.96 | 1,085.57 | 31.03.2022 162.14 | 31.03.2022 64.65 | 7. | Other Ec |
| Fotal Income from Operations (Net) Net Profit / (Loss) for the period before Tax, Exceptional and/or Extra Ordinary Items) | 346.06 | 326.65 | (128.12) | (38.80) | 8. | Earning for conti 1. Basic 2. Dilute |
| Net Profit / (Loss) for the period before Fax, (after Exceptional and/or Extra Ordinary Items) | 345.98 | 326.57 | (129.12) | (39.80) | | otes: The abov |
| Net Profit / (Loss) for the Period after tax, after Exceptional and/or Extra Ordinary Items) | 345.98 | 326.57 | (129.12) | (39.80) | | the Stock format of <u>www.bse</u> |
| Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the | | 020101 | (120112) | (00100) | 3. | The abov held on N The Boar |
| | | 326.57 | (129.12) | (39.80) | | ate: May 2 lace: Mum |
| period (after Tax) and other Comprehensive Income (after Tax)] | 345.98 | 020.01 | (| | | |
| period (after Tax) and other Comprehensive Income (after Tax)] Equity Share Capital | 345.98 1,250.00 | 1,250.00 | 1,250.00 | 1,250.00 | | |
| period (after Tax) and other Comprehensive Income (after Tax)] | | | . , | 1,250.00 | | |
| period (after Tax) and other Comprehensive Income (after Tax)] Equity Share Capital Reserves (Excluding Revaluation Reserves) as shown in the Audited | | 1,250.00 | 1,250.00 | 1,250.00 | | |
| beriod (after Tax) and other Comprehensive Income (after Tax)] Equity Share Capital Reserves (Excluding Revaluation Reserves) as shown in the Audited Balance Sheet of Previous Year Earning Per Share (of Re. 1/- each) for Continuing And Discontinued | | 1,250.00 | 1,250.00 | 1,250.00 | | |



cello Wim Plast Ltd.

Regd. Office : Survey-No.324 / 4 to 7 of Kachigam, Village Kachigam, Daman-396 210. Tel.: (022) 2686 3426/ 3427 | Email : wimplast@celloworld.com CIN : L25209DD1988PLC001544 Website : www.cellowimplast.com

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2023

| | | | | | | | | | | | ans except EPS) |
|-----|--|-----------------------|-------------------------|-----------------------|-----------------------|-----------------------|-----------------------|-------------------------|-----------------------|-----------------------|-----------------------|
| | | STANDALONE | | | | | CONSOLIDATED | | | | |
| Sr. | Post of the second | QUA | RTER ENDED | | YEAR ENDED | | QUARTER ENDED | | | YEAR ENDED | |
| ۷o. | Particulars | 31.03.2023 Audited | 31.12.2022 Unaudited | 31.03.2022 Audited | 31.03.2023 Audited | 31.03.2022 Audited | 31.03.2023 Audited | 31.12.2022 Unaudited | 31.03.2022 Audited | 31.03.2023 Audited | 31.03.2022 Audited |
| 1. | Total Income from Operations (Net) | 9,051.80 | 7,965.41 | 9,426.09 | 32,942.57 | 31,675.41 | 9,051.80 | 7,965.41 | 9,455.58 | 33,061.73 | 31,875.14 |
| 2. | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items) | 1,657.01 | 1,299.53 | 1,664.47 | 5,442.92 | 4,759.32 | 1,727.87 | 1,299.60 | 1,631.37 | 5,557.92 | 4,676.61 |
| 3. | Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items) | 1,657.01 | 1,299.53 | 1,664.47 | 5,442.92 | 4,759.32 | 1,727.87 | 1,299.60 | 1,631.37 | 5,557.92 | 4,676.61 |
| 4. | Net profit/ (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items) | 1,249.85 | 960.49 | 1,207.24 | 4,078.27 | 3,533.92 | 1,320.71 | 960.55 | 1,183.10 | 4,182.04 | 3,472.49 |
| 5. | Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)] | 1,175.63 | 924.08 | 1,202.64 | 4,042.17 | 3,562.68 | 1,246.49 | 924.14 | 1,188.11 | 4,132.80 | 3,525.03 |
| 6. | Equity Share Capital | 1,200.34 | 1,200.34 | 1,200.34 | 1,200.34 | 1,200.34 | 1,200.34 | 1,200.34 | 1,200.34 | 1,200.34 | 1,200.34 |
| 7. | Other Equity | | | | 43,156.83 | 40,074.92 | | | | 43,154.90 | 39,982.36 |
| 8. | Earning Per Share (of Rs. 10/- each) for continuing and discontinued operations) 1. Basic 2. Diluted: | 10.41 10.41 | 8.00 8.00 | 10.06 10.06 | 33.98 33.98 | 29.44 29.44 | 11.00 11.00 | 8.00 8.00 | 9.94 9.94 | 34.73 34.73 | 29.13 29.13 |

ve is an extract of the detailed format of Audited Financial Results for the quarter and year ended March 31, 2023, filed with k Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full of Financial Results for the quarter and year ended March 31, 2023 are available on the Stock Exchange website <u>eindia.com</u> and on the Company's website <u>www.cellowimplast.com</u>. ve results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings the results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings

May 29, 2023. Ird of Directors recommended payment of dividend at ₹8.5 per Equity Share for the Financial Year 2022-23 at their meeting.

29, 2023

Pradeep G. Rathod (CEO, Chairman & Managing Director) (DIN - 00027527)

Sd/-

For and on behalf of the Board of Directors Wim Plast Limited

(₹ In lakhs except EPS)



MAZAGON DOCK SHIPBUILDERS LIMITED

(Ship & Submarine Builders to the Nation)



EXTRACT OF FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2023


| Particulars | Consolidated Financial Result Quarter Ended For the year end | | | | | | | |
|---|--|---|---|--|--|--|--|--|
| i articulars | March 31, | | March 31, | March 31, | Marc | | | |
| | 2023 | 2022 | 2022 | 2023 | 20 | | | |
| | Audited | Unaudited | Audited | Audited | Auc | | | |
| Total income from operations | 2,28,983 | 1,99,175 | 1,52,545 | 8,51,401 | 6,14 | | | |
| Net Profit for the period (before tax, exceptional and /or extraordinary items) | 39,953 | 45,173 | 18,201 | 1,40,268 | 76, | | | |
| Net Profit for the period before tax (after exceptional and /or extraordinary items) | 39,953 | 45,173 | 18,201 | 1,40,268 | 74, | | | |
| Net profit for the period after tax (after exceptional and /or extraordinary items) | 32,619 | 35,416 | 15,901 | 1,11,903 | 61, | | | |
| Total Comprehensive income for the period [comprising profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 32,564 | 35,222 | 15,947 | 1,11,892 | 60, | | | |
| Equity Share Capital | 20,169 | 20,169 | 20,169 | 20,169 | 20, | | | |
| Reserves excluding Revaluation Reserves as at Balance Sheet date | | | | 4,55,847 | 3,65 | | | |
| Earnings per share (Nominal Value of share Rs.10) (Not annualised) | | | | | | | | |
| Basic: | 16.17 | 17.56 | 7.88 | 55.48 | 30 | | | |
| Diluted: | 16.17 | 17.56 | 7.88 | 55.48 | 30 | | | |
| | | | ne Financi | | | | | |
| Particulars | Manala 24 | Quarter Ende | | For the ye | | | | |
| r al liculai 5 | March 31, 2023 | December 31, 2022 | March 31, 2022 | March 31, 2023 | Marc 20 | | | |
| | Audited | Unaudited | Audited | Audited | Auc | | | |
| Total income from operations | 2,31,104 | 1,99,175 | 1,52,545 | 8,54,066 | 6,16 | | | |
| Net Profit for the period (before tax, exceptional and /or extraordinary items) | 42,074 | 45,173 | 18,201 | 1,42,933 | 78, | | | |
| Net Profit for the period before tax (after exceptional and /or extraordinary items) | 42,074 | 45,173 | 18,201 | 1,42,933 | 77, | | | |
| Net profit for the period after tax (after exceptional and /or extraordinary items) | 31,800 | 33,726 | 14,492 | 1,07,272 | 58, | | | |
| Total Comprehensive income for the period [comprising profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 31,786 | 33,551 | 14,494 | 1,07,264 | 58, | | | |
| Equity Share Capital | 20,169 | 20,169 | 20,169 | 20,169 | 20, | | | |
| Reserves excluding Revaluation Reserves as at | | | | 3,97,587 | 3,11 | | | |
| Balance Sheet date Earnings per share (Nominal Value of share Rs.10) | | | | -,, | | | | |
| (Not annualised) | | | | | | | | |
| Basic: | 15.77 | 16.72 | 7.19 | 53.19 | 29 | | | |
| Diluted: | 15.77 | 16.72 | 7.19 | 53.19 | 29 | | | |
| | and Disclosure I www.nseindia.co pment and is exe ated 5th June, 20° committee and ap 3 of ₹ 13836 lakh on behalf of t | Requirements) Regul n and www.mazagon impted from 'Segmer 15. In view of the abov proved by the Board s (i.e ₹ 6.86 per share the Board of Dire | ations, 2015. The dock.in. nt Reporting' vid re, no disclosure i of Directors at the). This proposed of ectors | full format of the C e notification S.O. is made separately e meeting held on | Quarterly : 802(E), c y by the C 30th May | | | |
| Sd/- Sanjeev Si Chairman and Man (Additional C Pate : 30th May, 2023 | inghal aging Directo Charge) Finance) | Cdr Jasbir S r Di (Subi Heavy E | Sd/- Singh, IN (Reto rector marine & ngineering) 08556592 | d) Azac Amrit | di _{Ka} Maho | | | |
| Place: Mumbai DIN - 0764 | | | | | | | | |

#BSMorningShow

Infocus

Is JioCinema ready for the big league?





Will recession in Germany hit the Indian economy?



Has the rally in Adani stocks run its course?

5

| Get the | |
|------------|--|
| answers in | |
| today's | |
| episode | |



Visit mybs.in/MorningShow

or scan this code to watch.

🔘 business.standard 💟 bsindia

adar

business-standard.com

🔊 5paisa presents

¤Business Standard

Mon - Fri | 8am

ORNING

ગુજરાતમિત્ર તથા ગુજરાતદર્પણ , સુરત

જાહેરાત હું નીચે સહી કરનાર સેલર અમિયાબેન જયેશભાઇ ઠે, ગુસ્લામી આગળાંદ

9/સ્વામી આત્માનંદ સરસ્વતી સોસાચઢી, ર શેરેર રોડ, સુરતના આથી જહેરાત થકી જહેર જણાવું છું કે:-

ુટેટામાં દર્શાવેલ મારા પતિ નામે જચેશભાઈ નાનાભાઈ સેલર સાથે લગન થયેલા મારા પતિ આજથી આશરે છ વર્ષ પહેલા મને તથા અમારા પરિવારન

છોડીને કચાંક ચાલ્યા ગયા છે. તેની ઘણી તપાસ કરી પરંતુ આજદીન સુધી તેઓની કોઇ માહિતી મળી નથી તેઓનો કોઇ અતો-પતો મળી આવતો

મિલકત વેચાણ અંગેની જાહેર નોટીસ

बन्नवी का अर्थव न मोदीज कामी प्रायम्प्रमंतु के कुला : प्रोत्मीक, कुला सेवी : साम दीसुविक्ता मांग में accurre मोदी को स्तेन प्रायम्प्र की मिलाकों प्रोप्ता भाग भेगी दीने की भाग का 1 (संस्वा-प्रियदा), इसाल्य प्रोद्ध नंगदा : स्वर्थ (से मिलाकों प्रायम् भाग भेगी दीने की भाग का सामे प्रायम् साम का साम ब्रह्म सामनी प्रायम् का सामित करने प्रायम् साम भागित भी साम की मांग मांग की मिलाकों का साम प्रायम् मांग का साम बादा मिलाको, प्रायम् का सामित की साम का साम का साम का साम का साम का साम की साम मांग प्रायम् का साम की साम मांग प्रायम् का साम की साम मांग प्रायम् का साम को साम मांग प्रायम् का साम को साम मांग प्रायम् का साम का साम

જાહેર નોટીસ

ર નં. ૧૦૧, ૧૦૨, રે.સ.નં. ૫૦૬ પૈકી ભાગ બી(૨), ગામ–આભવાન ચાણ અંગેની તથા તેના દસ્તાવેજો ગુમ થયા અંગેની જાહેર નોટીસ

ાની મુદ્દુત વીલ્યે ઢમારા અસીલ વેચ કોઈની કોઈપણ ખતની તર-તકરાર ભારળાદ કારળા કારળા કારપાટ પ્રતાના તર-તકરાર તા. ૩૧.૦૫.૨૦૨૩ ઔફિસ મંબર ૪૦૨-૪૦૩, પોટોન પાસ, શ્ટાર ભષ્યરની ભાષુમાં, અડાપણ, સુરત, મો. ૯૬૮૫૦ ૨૬૨૬૫

મળતા બળબંદાળ પણાવબાયું છે. ઇસ્ટ્રેકિટ સુરદ વોર્ડ નં-૨ માં આવેલ સીટી સર્વે નં- ૪૬૧૭ થી નોં અને તે જમીન ઉપર ચાલી આવેલ જુના બાંધકામ

& भां हमोने नीचे शाखवेस रे वेपाय जन्म डीई आहित प्यरि पर इत्य डरे-डरापे तो ते जंगे

લ્મીનમાં મંજુર કરેલ ચલન મુજબ ૫ ૧ શામછી શાક અને સ્વ. સ્મીલાઇ અને (૨) કેનકી ઉમેશકમાર જરીવ

sie aisi

તામું : 1/11૯૭, ઓફીસ નં.-૧૦૧, શ્વર બિલ્કીંગ, કાકાજી સ્ટ્રીટ, વપુરા, સુરત, મો.૯૯૦૯૮ ૯૭૦૫૪

ਗਕੇਰ છે. ਪਟਂਜੂ ਣਵ ਸ਼ਰੀ ਬਈ ਸਕੇਰ છੇ, ਜ કે સર્થ અસેલ છે, તંતુ જણવા, તરાવ્યુ પવાનું અને પ્રત્યસ કળવે સુવસ્ત વારસદાર, લેંક, નારાકીલ સંસ્થા,

ામાણું છે. અહીં હેણે, જેની સ્પષ્ટ નોંધ

'તારાનોમ'', બી-વિગ,લાલગાઈ કોન્ટ્રટક્ટર 'પાલગ,નિલાર્ક મહાદેય મંદિદની સાપૂર્યા, , શુરત. સમય સબારે ૧૭ થી ૧૧, સાંજે : જ થી ૯ -પ-૨૦૨૩)

પ્રણાનો પાકો દરતાવેજ તેર ૨ સાઉણે નથી, તેની બાહેર

ભાર્ગવ કે. ભેડા એકવોકેટ

-ડિસ્ટ્રીકટ સુરત, તાલુ ૧૬૭.૧૨૬ યો.મી ક્ષેત્ર

सहितनी हुए वि. सेम्ब

પ્રતિક સી. જરીવાલા (એક્વોકેટ

े 1 डटवालुं लखी क्ररेप प्रे. केंबी सप्टरकु मे 1, मंडली वा अल्व सरकारी, स्वर्धसरहारी

જગદીશચંદ્ર આર. શાહ

સંદીપ ડી. નાચા

હરિશ આર.પટેલ

એડવોકેટ અને નોટરી

ો નીચે તથી કરનારને રળા મળતું. એ તેમ કરવામાં કશુર થા ગુક થ કારના લાગ્યમાંગ, કલક, કિંત, સંબંધ, બોબ, લોન આ ચાર્જ નથી સને

જાહેર નોટીશ

ટાઇટલ ક્લીચરન્સ સર્ટીકીકેટ અંગેની જાહેર નોટીસ

ાર પર સુધ સાંચી. થી. પ્રધારકાર મા ભ્યોડિક મા લી. ના પ્રધારકાર માંકુ લીનીવાસા રાવ માણે ભારા જે મરીતાં તે પાંચે હતું. સંસ બાઉલા વીચે પાસેવી રછ વેસાલ દા છ વેસાય દરવાવેલ માને કુરતાં સામ રાજ સાંકેમની થોડીમાં સ્વતું. વિશ્વની નોપસ દા જે વેસવા દરસાવલેલ પર ક્યાં સામનાના મનાનો માં બેલાની નોપસ દા જે વસવા દરસાવલેલ પર ક્યાં સામનાના મનાનો માં બેલાના નાપસ દા જે વસવા દરસાવલે ક્યાં જે આવા મનારા છે.

તેઓની કોઇ માહિતી મળી લશા તળાના કન્ટ નથી, તે હકીકત સધોને હું આથી જાહેર કરું છું. સાર્ડા ડેટ્ [સેલર અમિયાબેન જવેશન

હેર નોટીસ :



ગુજરાત પાણી પુરવઠા અને ગુજરાત પાણી પુરવઠા અંદ નિધિકા નં ૧૪/૨૦૧૯-૨૩ તેલ કી નં ૧૯૧૬ અંગળ, દચગુર રોક, અભ્યાં વલસકા દ્વારા બોલેન વસ્તકનાં ડાંગ જિલ્લાના (૧) તા. આહવા (૨) તા. વાય ભરા (૩) તા. સુલીર માં મીની પા.રુ. વોષ્ણા બનાવાના લાય પ્ર થયં શકે મ. અને આંક દ્વારા બોલેન વસ્તકનાં ડાંગ જિલ્લાના (૧) તા. આહવા (૨) તા. વાય ભરા (૩) તા. સુલીર માં મીની પા.રુ. વોષ્ણા બનાવાના લાય પ્ર થયં શકે મ. અને આંક હોવ્યું તે અંદાવાર લગા (૧) દા. ૬૮,૯૯ લાન (૩) દા. ૬૮,૯ લાન (૩) દા. ૬૮,૯ લાન ભારે હોવ્યું તે આંક પ્રોત્ર છે. ૬૯,૯ લાન (૩) દા. ૬૮,૯ લાન (૩) દા. ૬૮,૯ લાન ભારે હોવ્યું તે આપતા અને આનુતારી દોરદારો પાસેલી માંગળામાં લાયે છે. રસ ધરાવતા પગલદારોએ ટેન્ડર રૂ/બનાનાની રચન નીવત નમુદ્દ ધરેલ અલ્લ, બ્લક્ટ પ્રાત્રબાદ વારા આવી રહેશે. હવે પ્રધાન સુધના સ્વાયકા માટે આ નોટીસમાં દાશીલે ઘલ સાયદ ધપર તેવાનું હોવે. ટેન્ટર કડીનલોક/છપલોડ કરવાની છેલો તા. ૨૨-૧-૨૦૩, ૧૮.૦૦ કરવાના સુધીની પહેશે. નં. માઉતી/uaests/va/aesa



પ્રવેશ જાહેરાત ૨૦૨૩-૨૪ અનુરનાતક અભ્યાસક્રમો માટે સુંચી અને બાપર પ્ શિંચાયર સ્થાન ા વિભાગો/સંલગ્ન કોલેજો/ઇન્સ્ટીટચૂટ દ્વારા ચલાવવામ ના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે તારીખઃ ૦૧/૦૬/૨૦૨: ાતા અનુરન ોનલાઇન પ્રવેશ ફોર્મ ભરી શકાશે, ઓનલાઇન ફોર્મ ભરવાની તથા પ્રવેશ થી ઓ થો ઓનલાઇન પ્રવેશ કેમ ભેરી શકાશ, આનલાઇન કેમ ભરવાનાં તથા પ્રવેશ અંગેની સામાન્ય સુચાલાનો તથા માંગેદર્સિકા સંબોલિત બિગ્તો માટે સુનિવર્સિદી વેબસાઇટ www.spuvvn.edu/ students_comer/admissions ની મુલાકાલ લેવા અથવા તો દેબ લાઇન નંબર: 8000338888 ઉપર મીસ્ક કોલ કરી કારક હતાર લીકે મેળવી વિવિધ માહિતી કાઉલ્લોક કરી શકાશે. ફક્ત ઓનલાઇન અરજી કરેલ વિદ્યાર્થીઓનેજ પ્રવેશ માટે ધ્યાનમાં લેવાશે. ઓનલાઇન ગરજી કરવાની છેલ્લી તારીખઃ ૧૫/૦૬/૨૦૨૩ છે. જેની ખાસ નોંધ લેવા વિનંતી.

વલ્લભ વિદ્યાલગર ગુજરાતના શૈકાશિક હબ તરીકે પ્રખ્યાત છે. લીકા અને અંગિયમાં સમગ્ર છાંક માત્રે અને અંગેલ્ડને અંગિલામાં આત્માં બાજવાની છે. 'કેલિયા માત્ર (પૂર) અને (ર) તેના લી કેલિયાકુ વર વીલાલ (પૂરી) ની સંગ્રુપ્ત માત્રીની લાદો ત 'જ' <u>પ્રદેશ, નં, પર, સાલી પ્</u>રથીના (૧) રસ- આંધુમાં સાચંદ પાલના પાસ્ટારાતે ૧. ૧ પૂરે કુલુમાં માંત્ર (પાલી), ૧. ૨ પીનાન્ડ્રેને સાચિરુપાર માત્ર (પૂરી), ૧. ૩ તેમિય કલ્લેમાં માત્ર (૨) પ્રદેશ સાચી, ઉપરાંત છે. (પ્રદાર (પ્રદાર) કિસ્ટે) અને (૨) પ્રંતુવારેના સાગુમાં માત્ર (પ્રદાર) માંત્રી કેલ્ટ્રા માંત્રી, જ્યારેન (રેપાસ) નારે લોકોઓ અને (૨) પ્રંતુવારેના સાગુમાં માત્ર (પ્રદાર) મીડી કેલ્ટ્રા માંત્રી, જ્યારેના કેલ્ડોના નારે લોકોના માંત્રીના સાવેલા સાગ્રેણ સાગલ વધ્યો માત્ર ક્લોન માત્ર પ્રદ મીડી કેલ્ટ્રા પાલી, જ્યારેને કેલ્ડોના માંત્ર પોલના માંત્રીના સાવેલા સાગ્રેણ સોળના અને માર્ટેલ્યા દાવેલા તે છે તે માર્ટેલ્યા કો છે તે છે. તારીખઃ ૩૧/૦૫/૨૦૨૩ G2@ યલ્લભ વિદ્યાનગર (માહિતી/આશંદ/૨૧૯/૨૩-૨૪) કુલસચિવ augsanni ગુજરાત સરકાર મહેસુલ વિભાગ સચિવાલચ, ગાંધીન ແ, ວາເຮົາສາຈ (જમીન સંપાદન પુનઃસ્થાપન અને પુર્નવસનાં વ્યાજબી વળતર અને પારદર્શકતા અધિકાર અધિનિયમ- ૨૦૧૩) (૨૦૧૩નો ૩૦મો) જિલ્લો :- સુરત સુમંદ : આત્મ-૨૦૨૩- ૧૦૦ - વગ્સત-૧૨૨૦૦૩-૯૫-ઇ તારીએ :- ૧૬/૫ /૨૦૨૩ આ સાલેતી અસ્તુ-દિમાં દાર્ચાવ્યમાં આવેલ વગ્તનિની એટ રહ્ય તારે એટલે કે, સૂરત મેટ્રો શ પ્રેજેક્ટ કોરોડોન-૨ અંતડોત અડાપ્યા ગામ મેટ્રો સ્ટેચલ એસ્ટ્રો છેલઝોટ-૨ના 'મહેર હેતુ લા આંતરમાળામારીઘ પ્રોપેક્ટ માટે 'પરૂચ પડવાનો પ્રોલા વે, એતું પુરુષરા સરકારને પ્રચાય છે. (૧) તેલી વગતિ સંપાદન વગ્નીલ સંપાદન પુનારા છેલા પ્રોપેક્ટ અન્યો પ્રતારમાં વ્યાપણ પ્રાવર છેલ પ્રારક્ષ કે બેલું લા આંતરમાળામારીઘ પ્રોપેક્ટ અન્યો પ્રતારમાં આવેલ પ્રેણે પ્રાવર સરકાર અલ્લો છિલ્લ ગમોનો ઉપરોક્ત અન્યો પ્રતિક્રામ અન્ય છે તે નો ઉલ્લા-૨(૧) તાદા તે એટોના દિમારીથી પ્રોપેક શ્રીકાર અન્યો ગુરુષરા સરકાર આથી છિલ્લ ગમોનો ઉપરોક્ત આંતરમાળામારીઘ પ્રોપેક્ટ અન્યો ગુરુષરા સરકાર આથી છિલ્લ ગમોનો સ્પોટલ આંતરમાળામારીઘ પ્રોપેક્ટ અન્યો ગમેકેટ કોમોડોર-૨ અંતડોલ પ્રચાયલ ગામ મેટ્ટો ટેસના એસ્ટ્રી/ એઝોટ- આં 'મેકેટ કોમોડોર-૨ અંતડોલ પ્રચાયલ ગામ મેટ્ટો ટેસના એસ્ટ્રી/ એઝોટ- આં પ્રેપેક્ટ માટે સંપાદન સરબાળામાં સ્ટોપ્ટાયન સરવા થયે છે. તથો આં પ્રેપેક્ટ કોમોડોર-૨ આંતડી વેડપાટના સરબાય છે તો છે. (૩) વે વચારે ઉપયોક્ત આંતરા સેચરબ ૧૨૦ ના ગ્રેપ્ટ અંત ને તે ત્રે?. અડવાની ચતી સેગ્રેજળ ૧૨.૦૦ સો.મી. અને તો તે તે તે તે છે. (૩) વેર વચારે કે પાયેક્ટ સંગદાર સરક્ય આવેલ છે. (૩) વેરી સરકે વ્યાપેક્રોલ આંતરાટ સંગ્રેજા પર વ્યાપ્યા સરકાર આથી વર્ષે તે તે છે. અડવાની ચતી સેગ્રેજળ લગ્લ અટવાય છે. (૩) તેથી સરકર્યુ આદિતિયમની લાયન-૨૦ (સે) (પત્નીન સંપાદન પુલ્ય સ્વચર આયા અરે પુર્વાયસથા બાયલ બાય છે. અંતુ પુર્વિય કેટો ગ્રેટ પ્રેપેક્ટ કોરોડોટ-૨ અંતરાં વાયા વ્યાય સ્વાયક વાલી નીચે સ્વાયલ અનુસુધિમાં આપિલ્ય સ્વેલ સેસ સેગ્લર લગ્ડ આથી જેટ હિતમાં 'સુટલ મેટ્રો ટેલ પ્રેપેક્ટ કોરોડોટ-૨ અંતરાં વચા વચક આથી જો ચે ચેલાન અતે માં સેટ સું બ્રિલિયમના પ્રકટકા ૨ અને ૩ ની એગપાળીઓની અમલવાસીમાંથી પુર્વિત સ્વાયે છે. અલુસૂથિ સુરલ મેટ્રો રેલ પ્રેપેક્ટ કોરોડોટ-૨ (અને ૩ લો અને ગ્રે બેડી અટેક્ટ ગરેટ). જિલ્લો :- સુસ્ત કુમાંક :- અમ-મ-૨૦૨૩- ૧૦૦ -જસત-૧૨૨૦૨૩-૯૫-દા તારીખ :- ૧૬/૫ /૨૦૨૩ તમાં ૩૧.૦૫.૨૦૨૩ ોફિસ ં સી-૪, સૌમીલ એપાર્ટમેન્ટ, દકવાલાઈન્સ, સુરત- મો.નં. ૦૮૨૫૪ ૭૧૯৬૩ નીચે જણાવેલી જમીન શીમતી રેપાએન સુરેશભાઈ મોદીની વિધ્યા, શ્રી ચેનનામાઈ સુરેશમાઈ મોદી અને શ્રીમતી સુનિતાબેન સુરેશભાઈ મોદી ને કુળાંચકુપાર પરતાવિયાની પત્ની રહે. ચેર ૪૭, સુદરવન રે-તહેણ, જાહોચીરાસ, સુરતનાં પોતાની જાહીપારી માશીકીની તથા પ્રત્યક્ષ કાંબળ ભાગેવટથી હોવાનું જાણવીની હમારો અસીંશને વેચણા કરવા માંચે છે. આ વેચણ વ્યવારા વેબે મળ જમીન માશીકો સહિતના જો સાઈને વાંધો થા તર-તકાર હોય થા સર જમીનમાં કોઈપણ જમીન માશીકો સહિતના જો સાઈને વાંધો થા તર-તકાર હોય થા સર કાંક --ચારિકાર હાળ કે નાળકી શ્રેષ સરધા ચિંચેનું તો છે. આ કતાર હોય થા સર તક્ક --ચારિકાર બાખ કે નાળકી શ્રેષ સરધા ચિંચેનું તો છે. આ કતાર હોય થા સર તકક --ચારિકાર બાખ કે નાળકી શ્રેષ સરધા ચિંચેનું તો છે. આ કતાર હોય થા સર તકક --ચારિકાર બાખ કે બાળકી શ્રેષ્ટ્ર સરધા ચિંચેનું તો છે. આ કતાર હોઈને ચોચ્ય થા તર ત-તકાર હોય તે ત્યા કે બાળ બાખ કોઈ નો પણ લોય થા તર ના કાર અને છે તેમજ આ વેચાળ વ્યવસાર વાબતો કોઈ ને પણ લોય થા તર ના સ્ટાર બોચે નો સ્ટાને પાંચકા છે. છે તેમજ આ વેચાલ વ્યવસાર વાબતો કોઈ ને પણ લોય થા તર ના કાર અમીં છે પણ કારના છે તેમજ આ વેચાલ વ્યવસાર વાબતો કોઈ ને પણ લોય થા તર ના સ્ટાર અધીર ચાંચે થા તર બાસીય પાક લાભ્યુ કારની શેરા, તે ના સ્ટાર વાબતો થા વાબતો છે પણ કારનો કાર છે કામ્ય બાની ચાંચ કાર બાંચા ત તકાર ચારણ તો તી નો થયે શોર મત્મ્ય ગગપત આગળ મામ જવા વાય લગા. જથીનવી વિગત : સુરત જિલ્લો, પલસાણા તાલુકો, મોજે ગામ લાખનપોર નાં લ્લોક નં.: ' થી તોંઘલેલ બિન્જાતીન જથીન કે છેનું ક્ષેત્રકળ સુમારે ૩૨૩૭ સમ ચો. ચીટર છે, જેનો આક રૂા. ૪.૦૦ પૈસા છે. તે વિગતની જમીન. (er av અનુસૂચિ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ કોરીડોરન્ર (અડાજધા ગામ મેટ્રો સ્ટેશન એન્ટ્રી/ એક્ઝીટ-૨)

| Freeh: | | | કો: અડા | | મોજે. અકાજણ |
|--------|----------------------------|----------------------------|-----------|----------------|---------------------------------------|
| રમ.નં. | ટી.પી.નં. | એફ.પી. નં. | सर्वे नं. | સીટી સર્વે નં. | સંપાદિત જમીનનું ક્ષેત્રફળ (ચો.મી.) |
| ٩ | 9E (अऽ!9'8) | 65 | ę | | 69.00 |
| | | કુલ | | | 64.00 |
| | ના રાજ્યપાલ માહિતી-સૂરત | શ્રીના હુકમથી /333/૨૦૨૩ | ਅਗੇ ਨੇਮਗ |) | ્પી. એન. ચાવડા) સ્કારના ઉપસચિવ |

તારીખ : મે 29, 2023 સ્થળ : મુંબઈ

cello Wim Plast Ltd.

રજિસ્ટર્ડ ઑફિસ: સર્વે *નં*.324/4 થી 7 ઑફ કાચિગામ, ગામ કાચિગામ, દમારા 396 210. ફોના (022) 2886 3428/ 3427 **1 ઈ-મેઈસ** wimplast@celloworld.com **સીઆઇએન:** L25209D1988PLC001544 | **વેબસાઇટ:** www.cellowimplast.com

માર્ચ 31, 2023 ના રોજ પૂરા થયેલા ત્રૈમાસિક અને વર્ષ માટેના તપાસેલ નાણાકીય પરિણામો સારાંશ

કેસઃયુ-૧૨,દિરલ આઠંડ. કિસ્ટ્રીકટ કોર્ટની સામે, અઠવાલાઇન્સ, સુરત.

| | | સ્ટેન્ડઅલોન | | | | | એક્રીકૃત | | | | | |
|-----|--|------------------------|----------------------------|----------------------|------------------------|------------------------|---------------------------------|------------------------------|------------------------|------------------------|-----------------------|--|
| | | પૂર્ણ થયેલ ત્રેપાસિક | | | પૂર્ણ થયેલ વર્ષ | | પૂર્ણ થયેલ સંમાર્શિક | | | પુર્ણ થ | મેલ વર્ષ | |
| 57. | વિગતો | 31.03.2023न। तपासेल | 31.12.2022สเ ดิเคสนเชิย | 31.03.2022m ਰਪਲੇਗ | 31.03.2023ના તપાસેલ | 31.03.2022ના તપાસેલ | 31.03.2023 <i>न</i> । ਰਾਪਲੇਲ | 31.12.2022สม ผิงสุดานเชีย | 31.03.2022ના તપાસેલ | 31.03.2023ના તપાસેલ | 31.03.2022ન તપાશેલ | |
| 1. | સંચાલન માંથી થયેલી કુલ આવકો (ચોખ્ખી) | 9,051.80 | 7,985.41 | 9,426.09 | 32,942.57 | 31,675,41 | 9,051.80 | 7,965.41 | 9,455.58 | 33,061,73 | 31,875.14 | |
| 2. | મુદત માટે થયેલો ચોમ્ખો નવો /(ખોટ) (કર, અપવાદરૂપ અને/અથવા અસામાન્ય આઇટમો પટેલા) | 1,657.01 | 1,299.53 | 1,664.47 | 5,442.92 | 4,759.32 | 1,727.87 | 1,299.60 | 1,631.37 | 5,557.92 | 4,676.61 | |
| 3, | મુદલ માટે કર પટેલા થયેલો ચોપ્ખો નકો/(ખોટ) (અપવાદશ્પ અને/અથવા અસામાન્ય આઈટમો પછી) | 1,657.01 | 1,299.53 | 1,664.47 | 5,442.92 | 4,759.32 | 1,727.87 | 1,299.60 | 1,631.37 | 5,557.92 | 4,675.61 | |
| 4. | મુદત માટે કર પછીનો ચોપ્ખો નકો/(ખોટ) (અપવાદરૂપ અને/અથવા અસામાન્ય આદરિમો પછી) | 1,249.85 | 960.49 | 1,207.24 | 4,078.27 | 3,533.92 | 1,320.71 | 960.55 | 1,183.10 | 4,182.04 | 3,472.49 | |
| 5. | મુદ્રત માટેલી કુલ સર્વગ્રાહી આવક (જેમાં મુદ્રત માટેલો લકો/(ખોટ) (કર પછીલી) અને અન્ય સર્વગ્રાહી આવક (કર પછીલી)સામેલ છે) | 1,175.63 | 924.08 | 1,202.64 | 4,042.17 | 3,562.68 | 1,246.49 | 924.14 | 1,188.11 | 4,132.80 | 3,525.03 | |
| 6. | ઇક્વિટી શૅર કૅપિટલ | 1,200.34 | 1,200.34 | 1,200.34 | 1,200.34 | 1,200.34 | 1,200.34 | 1,200.34 | 1,200.34 | 1,200.34 | 1,200.34 | |
| 7. | अन्ध राह्यिटी | | | | 43,156.83 | 40,074,92 | | | | 43,154.90 | 39,952.35 | |
| 8, | શેર દીઠ આવક (પ્રત્યેક રૂ.10/– તો) ચાલુ અને બંધ કરેલા કાર્યો માટે) 1. બેઝિક : 2. કાયવટ્ટેક : | 10.41 10.41 | 8.00 8.00 | 10.06 10.05 | 33.98 33.98 | 29.44 29.44 | 11.00 11.00 | 8.00 8.00 | 9.94 9.94 | 34.73 34.73 | 29.13 29.13 | |

ેશનુ પહેલી સેની (નિર્દિગ્ં ઓન્ટિનોમારલ એન્દ્ર ક્ષેત્રકલોસ્સ ક્ષિકલાસ્ટરણ) લિયાના 2016ના 33 ફેલ્મ ગોટલ્વસથાં નેશાયમાં અનેપા માર્ચ 31, 2023ના ગેજ પુત્ર કરેશને અનિશિક અને ત્યાં મુટે તપાસેલ નાશાથીમાં પ્રદેશમાંથી વિચાલા સેનેઆઈ ઉતારો છે. માર્ચ 32, 2023ના રોજ પણ દેશેલા ઝેમાંકિક અને વર્ષ માટે લાણાઉધ પરિણામોનો આખો લમૂનો શેલબપારની વેબસાઇટ <u>www.basindin.com</u> અને કંપનોની

વેબનાઈટ પ્રજ્યાદ્વાં બનાવક અન વધ માટે લાણાઉધ પરિણામોનો આખે લખૂનો શેરબાયતા બાદનાવ માટલા ઉપરાં છે. માર્ચ ડું, 2028મ કે બેલ્યાર્ટ પ્રજ્યાદવાં આવ્યા કે પ્રત્યાર્થ છે. આ ગામ કે બેલ્યા કે બેલ્યા કે બેલ્યા કે પ્રજ્યાદેવાં પ્રજ્યાદેવાં પ્રજ્યાં કે પ્રત્યોની ઉપર પ્રાણાવ પ્રદેશોમાં ઓરિટ કોર્ટી, ક્ષાર અમેણા કાર્યત તેમ જ બોર્ડ બેલ કલ્પેક્ટર્સ હાર મે 29, 2023 ના રોષ યોજાવેલ તેમનો સંબંધિત મંદિગમાં મંદૂર હેલે એક કાર્યક્રાટરોમે તેમના મિટિડામાં નાપાલી પ્રત્યે બેલ્યુ અને બોર્ડ બોલ કલ્પેક્ટર્સ હાર મે 29, 2023 ના રોષ યોજાવેલ તેમનો સંબધિત મંદિગમાં મંદૂર બોર્ડ એક કાર્યક્રાટરોમે તેમના મિટિડામાં નાપાલી પ્રત્યે બેલ કલ્પેક્ટર્સ હાલ મે 29, 2023 ના રોષ યોજાવેલ તેમનો સંબધિત મંદિગમાં મંદુર

બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ માટે અને વતી વિમ પ્લાસ્ટ લિમિટેક

મદીપ જી. રાઠોક (ਮੀਨੀ), ਬੋੜਸੋਰ ਅਤੇ ਸੋਰੋਵਿੰગ 5/ਪਟੇ522) (DIN - 00027527)

મોજે જીઆવ, તા.સુરત સીદી મજુરા, જી.સુરતના રે.સ.નં. ૩૩ બ્લોક નં. ૪૧૮ વાળી બીનખેતીની જમીનની વેચાણા અંગેની જાહેર નોટીસ

<mark>નયન એમ.ભગત - અમર ડી. દલવાડી</mark> એક્વોકેટ્સ ઓફિસ ઃ થુ⁄ ૧૨, અમીઝારા કોમ્પલેક્ષ, છલ્લા સેવા સદન-૨ ની સામે, સ, સુરત. મો.નં. ૯૮૭૯૫ ૧૯૦૯૧, ૯૮૭૯૬ ૮૨૧૦૦

વે નંબર ૮૪/૨ નવો બ્લોક/સરવે નંબર ૨૯૧ જમીનના વેચાણ છંગેની જાહેર નોટીસ

gen બગેક/સરચે નંબર ૮૪/૨ લગો જ્વોક/સરચે નંબર સરલ વાળી ખેતીની ઝાવી લાગત વયગત તમામને લાલની વેચાલ અંગેની જાતે રં નોટીસવી જણાવવાનું કે છાંગ તવસારી, તાલુકા વસસારી ના મોંજે પરતાવાર ગામના ખાતા નંબર-1૪૪, જુઓ હોસવારને વંગર ૮૪૪, ન વો ઓફસરસે વંગર-2૪૯ વા બાી ખેતીની જ્યોન જેનું વેચકળ ૦-પર-રુસ્ટ સાચે ચો.ગી. છે જે ખેતીની રમીન જે (1) આવા નંબર-1૪૪, જુઓ પંચ, (2) જ્યાસાયને નં અંગેલલાઈ પરંત (1) વિચા, (3) ચેચ અનિસ્વાઈ પરંત, (4) પંચ, (3) જ્યાસાયને નં અંગેલલાઈ પરંત (1) દિવા, (3) ચેચ અનિસ્વાઈ પરંત, (4) જ્યાસાયનં નં અંગેલલાઈ પરંત (1) દિવા, (3) આ અનિસ્વાઈ પરંત, (4) જ્યાસાયનં નં અંગેલલાઈ પરંત, (5) લ્યુડ અનિસ્વાઈ પરંત, (4) બ્લાન્સનાન પ્રંત અંગે બોરીન વા લાવી તરીકે છસામાલેન અનિસ્વાઈ પરંત, (5) તુધ અનિસ્વાઈ પરંત, (4) બ્લાન્સનામાં પરંત, (5) લ્યુડ-લપાર્ચ પરંતોના પરંતુ (4) ક્યાં માળ્યા છે પરંત, (2) બ્લાન્સનામાં ઇ પરંત, (2) બ્લાન્સનામાં પરંતુ, (6) ગ્લાપ્લાઈ દંશ, (2) બ્લાન્સનામાં કં ઉદયાનો કલ્પર, પંચ, (2) બ્લાન્સનામાં પરંતુ, (3) લે સ્વાયતીર્ગન ને ભારતીયેન પરંતોનામળાઈ પરંતના કં ઉદયાનો કલ્પર, લોગરલ, સાર્ચકરના પ્રંકત પાર્ચક, (3) ક્યાર્ગ, પાર્ચકરના પરંતુ, (3) સ્વાયતીર્ગન ને ભારતીયેન પરંતો સાધ્ય (2) સ્વી નં બ્લુલગાઈ પરંતુના વાળે સ્વાર્ગ, સાર્ચકરના પ્રંકતા પ્રંકત પરંતુ, (3) સ્વાયતા કરવા ચાં કરવા હોય સારકું ખેતીની જોવના વાનો સોફાડી, સંબીપાલક, સંક બ્લાન, લોપસંધ, સિર્ગસરકના માં કરવા માં સારગત, પ્રંકતમાં સાધ્ય બ્લાન્સ, સાંસકરના કંડ, ચેચાના સારગત, (1) તાખત, સોફાડની, સંબીપાલક, સ્વાય લાય સાચી દન્ત- થયા સંક્ર વાલ સારાયત, (1) તાખત, સોફાડન સંક્રોન વાલ સ્વાત્ર સોફાડના સારાયત, (1) તાખત, સોફાડની દંતુ ન વાલ સાચી, સારચંડ સાધે સ્વાય સિર્ગ ચાય સારે સ્વાત સંધાર સાધ્ય સ્વાય સાડના સારાયત લાગત સ્વાય સાધ્ય સારાયત, (1) તાખત, સંક સાથો તાન સાચ્ય સાચી કરવા સાય સાચ્યાસ્વાત સંક સાધાની સારાય સાધ સારાયત, (2) ત્યાયત સાધી સાઈ સાચ છે, સાય સાચા સાડની, ગોર્ગ વાયે સાય લાક્ય, લાગ્ય નાખત, સોટવિક, સંચીયોય છે, અંગર, સાચી, સાર્ચક, વાલ્યો, સાધે સાધ્ય સાધી, (3) સંચ માધેસ્ટલ સાધડ, લાગ્યોન અંગત ના નો અંને લીલ સાચ સાધ સાધે, સાચ સાધી, ગોલન સાચ્ય સાધે સાર્ચક, લાર્ચ, અલ્યોલ સ્વાય સાચ્ય સાધી સાધ્ય સાધ સાધ, સાધી સાધ્ય સાધી સાધ સાચ સાધીન સાધી સાચ્ય સાધ્ય સાચ્ય સાધ્ય સાટના સાધ્ય સાચ્ય સાધી લગે, અલ્યા સા

| Ashek. m. Rifel | ful |
|---|--|
| (૧) અસોકભાઈ મગનભાઈ પટેલ | (૬) ભૂપેન્દભાઈ પરસોત્તમભાઈ પટેલ |
| I. It. rule 1 | mente |
| (૨) જીશાશાભેન ને અનિલમાઈ | (૭) સંજયભાઈ ઉઠે બીપીનચંદ્ર પરસોત્તમભાઈ પટેક |
| મગળમાઈ પટેલની વિધવા .J. β. fuic (| HSAI MIG M. LEQ |
| (૩) શ્રેધ અનિલમાઈ પટેલ સમીર ના વાલી તરીકે જાલાસાબેન અનિલચાઈ પટેલ | (૮) મહેશભાઈ પરસોશમભાઈ પટેલ |
| J. A. Mie | on on well |
| (૪) ka અનિલયાઈ પટેલ સચીર ના વાલી તરીકે જાશભાબેન અનિલયાઈ પટેલ | (૯) ભગવનીબેન તે ભારતીબેન પરસોત્તમ પટેલની યુત્રી તે બદુલભાઈ પટેલની પન્મી |
| tabel . | હમ્પ્રસ અસૌલની સુચનાથી, |
| (૫) ક્રિસોરભાઈ પરસોત્તમભાઈ પટેલ | પટેલ ભાગ્ચેશ્વરી (એડવોકેટ) |

મીનું બાંધકામ મહિત લિભા

12મી. પ્લોળા એકઓલ

week runs sit: 4 facebook.com/W

550 100 સ્સાડી, સુરત. તા.૩૧-૦૫-૨૦૨ નં.૮, સિધમ કોમ્પલેટા, થોકડી પાસે,તરસાડી, કોરાંબા દોલ જી.સુરત. મો i ૮૮૨૧૫૦૩૨૩ ND. વેચાણ અંગેની જાહેર નોટીશ

પી.સુરત, તા. પાસસામાના ચોજે ચામ વડકાશના દે.સ.ને. ૨૨૨/૧, બધો.સાર્સે નં. ૨૨૭, જેન સંગ્રળ હી.ચારે. ૦- કપ્ટ- ત્ર ચો.ચી., જેમે ખાતા તે. ૨૫૩, જેમે બાહ્ય દ્રા. ૮-૧૮ પી સાચથી જે વી.સ્ટમ્સી બેની જેવી જેવી સ્ટાસ્ટમાં આવ્યું તે સ્વાચે માર્ચે માર્ચે માર્ચે પ્રત્ય કરતા. બેનાર દ્રા. અંગ પી સાચથી ગાંધ સ્ટા બોરિસ દેવન ચાલે આવેલ છે તે સ્વીમ પી ધુવં દિશા તરસ્યી નહેર લાગુ ૨૦ ગુઠા હક, દિશ, બિસ્સમી આવેલ છે અને તે જ્યાંન સર્વોત્રામાં ક્લેન અંગ બેનાર પ્રત્યા કાર્ય બાણ્ય, ચાંગ વચ, હાલ પ્રત્ય આવેલ છે અને તે જ્યાંન સર્વોત્રામાં ક્લેન અંગ બેનાર પ્રત્યા કાર્ય બાણ્ય, ચાંગ વચ, બાહ્ય તે સ્ટાર માં પ્રત્યે ઘુરો કરી આપી વે સાચ આપવાનું નકીક દેવ છે. આવી મજદૂર જવીનામાં કોઈ પ્રાગ્ય ક્લ બાહિત સ્વો- સાચે બાહ્ય વ્યાય સ્ટાર્ય કરતા માં દેવ છે સાથે પ્રત્ય પ્રત્ય કરતા કાર્ય બાદ કરતા કરતા કાર્ય બાદ્ય કર માં પ્રત્યે ઘુરો કરી આપી વે સાચ આપવાનું નકીક દેવ છે. આવી મજદૂર જવીનામાં કોઈ પ્રત્ય કરતા બાહિત સ્વો- ત્રહેન કરવી સ્વર્ય કે સંચ આ માં રોકેસ સંદર્ય સ્ટાર્ય ના કોઈ પ્રત્ય ને કરતા કરતા કરતા કરતા કરતા કરતા માં આવે હતું. સ્ટાર્સ ગુને સાચે બે પ્રત્ય સંચ આપવાનું નકીક દેવ છે. આવી મજદૂર જવીનામાં કોઈ પ્રાય કરતા માં ત્રાતે વ્યાય કરતા, કે પ્રધ્ય મે કે સંચ પ્રતિ સાચે ચોરી દિન- ૦૯ લાત) માં તે આગત વા પ્રાય સાધીત અપોને તે સિત્ર સરતા પ્રત્ય કરતા છે સાચે બાદ્ય ના આવે સ્ટાર્ય સાચે તે પ્ર કા સ્ટાર્ય ના કે વે છે પ્ર બાલનેને હડક, તિત, દેસ્ટલો જે વાલ અપાર દર- રાહો ના ચી બાદ્ય સાચે હોય તો તે આવી જાતા છે એ મા માનેને સરહ્યું જી માને વે ચાલ દરાયજ કરવો છે. તે તા તા પ્લ પ્ર તિ પ્રત્ય કે તે સંચ તો કે વે સ્ટાર્ય કે દરે સાચ્ય તો દેવ પ્ર દર સ્ટાર્ય

| બોફિસ : ૨/૨૪૦૩, દરજીશેરી, | જીગ્નેશ વી. ચૌહાણ |
|--------------------------------------|-----------------------|
| ાદરપુરા, સુરત. કો.નં. ૯૬૬૪૫ છપ૪૪૦ | તે ખરીદનારના એક્વોકેટ |

વેચાણ અંગેની જાહેર નોટીસ

આ જાહેર નોટીસ દાસ જણાવવાનું કે, નવસારી જીલ્લાના જલાલપોર તાલુકાના મોજે ગામના રેવન્યુ રેકર્ડના ગામના નમુના નંબર-૮-અ જમીનની ખાતાવહીના ખાત ા સામને વડ્યુ કંડીના ગામના ગુનુ , પ્લસ્તાર હાળાવા દાભાવા પ્લાપ્ત પ્રદાન માં છે છે. આ ગામને પ્લાપ્ત કરવા કે બે કે ગામના ગુના સંપર્ત જ ભ્યીનની ભાના સાચીના ભાના વંધર કર પ્રતિભારે આપર કરા : ૨૬ વર્ષ પ્લાપ્તથી ગુની સરનાની પ્લાપ્ત ખેતીની જ્યીન પંલા ગુના પ્લાપ્ત (૧) અમીનાલેન સુરક્ષાઈ મહામદની વિધ્યા, (૨) મહામદાસી ચુસ્કાળા પટેલ, રહેલા સાં (૧) અમીનાલેન સુરક્ષાઈ મહામદની વિધ્યા, (૨) મહામદાસી ચુસ્કાળા પટેલ, રહેલા સાં (૧) અમીનાલેન સુરક્ષાઈ મહામદની વિધ્યા, (૨) મહામદાસી ચુસ્કાળા પટેલ, રહેલા સાં પહેત કળીયા, આમાં લાડા, તાલુકાર પ્લાપાલેમ, જીવાના નસાઈને કરવાર કરવાર કરે છે. (૪) કિઝેઝલેન માં લાડ, તાલુકાર પ્લાપાલેમ, જીવાના નસાઈને કરવાર સાં સ્વાપ્ત કે સ્વાપ્ત કે તેના માની પંત્ર કર્યા વ્યુકાળાઈ પટેલ સ્વાપ્ત ગામ લાધી સ્વાધ્ય નો વ્યવ્યો પ્લાપ્ત અધીલન પંત્ર કરે શ છે જે થી સ્ટલ્યુ ખેતી વર્ષનામાં છે કોઈ બોલર, સંક યા સંચાયનો કોઈપણ પડકી કરેલા છે લેશે શરક્યુ ખેતીની વ્યનામાં છે કોઈ બોલર, સંક યા સંચાયનો કોઈપણ પડકી કરેલા છે લેશે શરક્યુ ખેતીથી વ્યનામાં છે કોઈ બોલર, સંક યા સંચાયનો કોઈપણ પડાસ કોઈપા સ્ટલ્યુ મેનકી સ્ટલ્યુ પોલી વર્ષનામાં છે કોઈ બોલર, સંચાય સંચાયનો કોઈપણ પ્રકારનો તકામ જાય કરવી, તેમ કરવામાં કહ્યુ થયેથી સ્ટરક પોનીની વર્ષનાન પાક સંજોશ ટાયદી લેશે અને તાને કરામાં કલ્ય કરિત કે બાધિકાર નથી અને હાય તો તે જતો સંચ છે ચાને કે છેટી દિધર છે તેમ ગર્શ દિવ કે અધિકાર નથી અને હોય તો તે જતો સંચ છે ચાને કે છેટી દિધર છે તેમ ગર્શો કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી. જે ની લામતાનાવાળતા તમામે નોય લેતી સાઠી. કાઈપણ દાયકા કોઈપિક કોઈપાસ કાર્સી લગ્ય દાર સું ખેતી જે તેમાં જે ની લાતાના કાઈપણ કાર લોકો છે લગ્ય તપાક કોઈપી છે. સાં સ્ટાપ્ટ સ્ટાપ્ત સ્ટલ થયા સાત નાઈ. જે લો સાતાના વાળતા તમામે નોય હોલી સાતી તાળા કોઈપી છે.

સાગર પા. રાઠાડ (અન્બરુઝ ઓ. ૨૦૬૪, પ્રથમ માળે, સાર એન્ડ સેસ શોપીંગ સેન્ટર, પોસ્ટ ઓફિસની બાજુમાં, મુ.પો. વેશ્વમ ૩૯૬૪૯થ, વાલુકાઃ વ્યવાલયોર, ગુલ્લાઃ નવાસારી, ગુજરાત. મો.: 098985 64135, d-મેર્કલ: adv_sprathod@yahoo.com

વેચાણ અંગેની જાહેર નોટીસ

વેચાણા અંગેની જાહેર લોકોસ સ્વયંત્ર તે છે. સુરત સીઠી, શહેર સુરતા માંગે. આજળતા વેન્સ હવે નંભર-૧૦૨, દી.પી. લીમ નંભર-૨૦૨ (શાહેર, સુરતના માંગે. આજળતા વેન્સ હવે નંભર-૧૦૨, દી.પી. લીમ નંભર-૨૦૨ (શાહે, સંગ્લ-૧૦૨, દી.પી. લીમ મંભર-૨૦૨ (શાહે, સંગ્લ-૧૦૨, દી.પી. લીમ મંભર-૨૦૨ (શાહે, સંગ્લ-૧૦૨, દી.પી. લીમ નંભર-૨૦૨ (શાહે, સંગ્લ-૧૦૨, દી.પી. લીમ મંભર-૨૦૨ (શાહે, સંગ્લ-૧૦૨, સંગ્લ લંદર, સંગ્લ-૨૦૨, સંગ્લ લંદર, સંગલ, સંગ્લ લંદર, સંગલ, સંગત, સંગલ, સંગલ, સંગલ, સંગલ, સંગલ, સંગલ, સંગલ, સંગલ, સંગત, સંગલ, સંગલ, સંગલ, સંગલ, સંગત, સંગલ, સંગત, સંગત, સંગલ, સંગત, સંગલ, સંગત, સંગલ, સંગલ, સંગલ, સંગલ, સંગલ, સંગત, સંગલ, સંગત, સંગલ, સંગત, સંગલ, સંગત, સંગલ, સંગત, સંગત, સંગ

| The arm what derive the seat. | |
|--|---|
| ઓફીસ સરબામું-૧૦૧, લીલા એપાર્ટમેન્ટ, દરજી શેરી, નાનપુરા પોસ્ટ ઓફીસની બાજુમાં, નાનપુરા, સુરત. | નિ૨વ એચ.દેસાઈ તે ખરીદનારના એકવોકેટ |
| | 1 1 2 2 1 |

🕼 Chola ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લિમિટેડ કોપોસ્ટ ભોફિસ ! પહેલો માળ, 'કેર હાઉસ', નં. 2, N.S.C. બોસ રોડ, ઘેસાઇ-600 001. ઈ-ઓડિશન સેલ નોટિસ (ફક્ત ઈ-બિડિંગ લારા પેયાણ) ઇક્યોરિટી ઈન્ટરેસ્ટ (ભેન્જોર્સમેન્ટ) નિયમો 2002ના નિયમ I (હ) અને 9(1)

aldel 43442

| | [6] | [0]] | [66] | 创 | [u and ato] | [8] |
|----|--|--|---|------------|---|---|
| H | લોન એકાઉન્ટ નંબર. ઉદ્યાર લેનાર(ઓ) મોર્ટગેર(ઓ)/ જમીલદાર(ઓ)તું નામ | 0/5 सेखां वसूत करवाला के (सुरवित हेर्यु) | रधावर मिलडत / सुरकित संपत्तिनुं वर्छन/ (१ ५५. ४४७, १७.७६ ५५. हानी समडव छे.) | soment use | દલ્તામત કિંમત (રૂ.મો) અનેસ મની કિંપેલિટ (રૂ.માં.) | ६१९९मी तारीम क अम्ब |
| | वील भवत लंबर XCHL3750001177001 1. कुछ विका (भाषित कहनी वास्तार करे वास्तुरमई कार वीद्यालन पन्नी) 2. वीपीवर (पर्वतीत कहनी वास्तार करे वास्तुराई कार वीद्यालन पुभी) 3.विग्रामर्थ (भाषीत कहनी वास्तार करे कल्तुराई कार देखालन पुभ) | en. 21.03.202049 19v 39,93,707/- (3. ad-auxilia ana cilia gana unsei) aaaa | સ્થાવર મિલકત ધરાવતા બોઢ નં. 278, એડીએમ. 52.01 થો. મીટર્સ. (રેવન્યુ રેશેર્ડ બ્લોક નં. 431/ 4/278 | | ३- 23,63,040/- (3. त्रेचीश जाम त्रेसक कंपार सासीस माम) | |
| 1 | कारणुकाल पान, सार्वकाल पुत्रा) सा , कीलसंगे (मार्थमित कानूनी साहस्था काने सानुराजनी कान, सीसालन पुत्री) 5. स्थार्थक (मार्थमित कानूनी साहस्था काने सानुराजनी कार, सीसालन पुत्री) 6. सिंदुर्जन (मार्थमित कानूनी साहस्था काने सानुराजनी कार, सीसालन पुत्री) 7. सीरीजनार्थ (मार्थमित कानूनी साहस्था काने सानुराजनी कार, सीराजन पुत्र) साहमे, सुराज, सुराधन उठेना के काने, काने, | and and | મુજબ), સાથે ૧૯.તક શો.મી. શેઠ અને સી.ઓ.પી.લી સ્વર્ગાતમાં સાવિધાર્થિત શેર "રાયુનંદન દેશેક્વને શાળ્યનાથા", પર સ્થિત છે. સાથે લંભર તલ અ અને ત્યાં, પર સ્થિત છે. સાથે લંભર તલ અ અને સ્વ તા. કામરેજ, મિંટ સુરત, ગુજરાત પર સ્થિત છે, વિગય ધનસુમાર્થ ચોઠવાની માધિકીનું. | earl | фनरः सावीत आ) 3. 2.30,304/- (2.4 वेधा प्रभाव दश्वर अक्षाजे साम आत्र) 3. 4.40,005/- (2. केंड वाभ प्रसात भाष) 3. 4.40,005/- (3. केंड | 16મી પૂસ, 2022 બપી 82.00 વાગ્યલી 94.00 પીએ |
| | aliar A/L., el. (tel)). : X044, 8114000(2299881 | и., 10.10.2023ні dv | ख्यावर मिलठत धरावता आंधठामला तमाम दुवडा कने पार्श्वव, डी प्रकार, जोव नं. ११० पेडी कंधर्ल साण्ड- प्रान्त मुक्य प्रधेड नं. ११०/५, कोडीकेंग. ४९.०३ को. मेरेडी मार्गिल, कोडी २३.२१ की. मेरेडर्स, देरेडली प्रमोजना करविजालिए जेर कते. | | ३- १४,३0,७50/- (३- सीर साफ स्तेशी इन्सर प्रधास मात्र) स्त | શુધી (દ મહિતન સરસવિત એકહેસ્ક એક ટેન્ડ દસ્વઈલ્લ |
| 2 | ા, કાઉતારીત નોડિસામાં વાસપીયા 2. નોડિસામાં પુરસ્વાત સામધા બંને સ્ટેચારી કરેત નાં. ૧૦૧, તિલુશામાં એવલીમન્દ્ર, ઊલ્લાનાગર શે. બાલ્લા સુરાત-ઉભ છા, ગુજરાત. | 8 20, 10, 450ý (3, tíln 634 ti 20, 1042 4033) eli 20, 1055 4033) | ગીઓપી હવા એડીએમએન. 72.31 એા.મી., બ્લોક બંદસ વર, પર સ્થિત "જા દિવાન્ટ"માં. દેબન્લુ સંવે તં. દ્ર., પ્રધાત વં. ત્યારક, એડીએમએન. 1 ઠેકદર કરા દિત્તાર કા શો.મી. એટલે કે, 1365 થો. મીટર્સ મોજે ગામ ભાષ્ટેપ, તો. કામેજ, (K. સુકડા, ગુજરાત ત્યાં હોર્મ કે છે. દર્દિશા - બહોર તં. રાગેમાં જો દેવર: દેદિશા - બહોર તં. રા, ''પૂર્વ: સોમામતીનો ખોલરિક માર્ગ, ''પવિકા પાટે હ. તે પ્રીગર. | acrel. | 1,48,005/- | වේමා විත.) |
| | . તપાસની લારીખ અને સમય : 14.0 . મિલિમમ બિડ ઇન્ક્રીમેન્ટ ૨૭મ : ૨. | | 11.00 વાગ્યાની વચ્ચે 4.00 પીએમ | | | |
| 3. | . સહભાગિતા માટે બિડ/ઇએમડી/વિ | તી પત્ર સબ | मिशन माहे छेल्ली ताहीजः 15.06.202 | in c | 2 05.00 vàai | <u>,</u> |

सारीमा ३६.१५.२०२३ अग्राः सुरत, गुणरत yly admisan v-lych-a oles que

| મુધવાર | 39 | मे, | 5053 |
|--------|----|-----|------|
| 9 | | | |